



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ- ૩૮૮૦૦૧



પ્રેસનોટ

હડકવાના રોગ અંગેની જાગૃતિ માટે એક દિવસીય વેબીનારનું આયોજન

વેટરીનરી પબ્લિક હેલ્થ વિભાગ, વેટરનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા વિશ્વ હડકવા દિવસ ના અનુસંધાને જાહેર જનતામાં હડકવાના નિયંત્રણ અંગે જાગૃતતા ફેલાવવાના હેતુસર તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ એક રાષ્ટ્રીય કક્ષાના વેબીનાર નું આયોજન કરવામાં આવેલ હતું. આ વેબીનારનું આયોજન કોલેજ ના આચાર્યશ્રી અને વિદ્યાશાખાધ્યક્ષ ડૉ. એમ. એન. બ્રહ્મભટ્ટ ની અધ્યક્ષતા, તેમજ ડૉ. એમ. કે. ઝાલા, સહ-સંશોધન નિયામકશ્રી, આકૃયુ, આણંદ કે જેઓ APCRI સંસ્થાના પશ્ચિમ ઝોનના પ્રતિનિધિ છે, તેમની સહ-અધ્યક્ષતા હેઠળ દ્વારા કરવામાં આવેલ હતું.

વિશ્વમાં પ્રતિ વર્ષ હડકવા દ્વારા લગભગ ૫૫ હજાર કરતાં વધુ સંખ્યામાં મૃત્યુ નોંધાય છે. તે અંતર્ગત, આ રોગની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘટાડો થાય અને મૃત્યુદર અંકુશમાં લાવી શકાય તે હેતુસર આ વેબીનાર વેટરીનરી પબ્લિક હેલ્થ વિભાગના ડૉ. જે. બી. નાયક, સહ-પ્રાધ્યાપક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં, આ વિષયના જુદા-જુદા નિષ્ણાતો દ્વારા ઘણી જ ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ થકી દેશના પ્રવર્તમાન હડકવા રોગ ની ગંભીરતા અને અટકાયતના પગલાં વિશેની વિષયવસ્તુની વિસ્તૃત છણાવટ કરવામાં આવી. આ કાર્યક્રમ સમગ્ર વિશ્વના લોકો ભાગ લઈ શકે તે હેતુસર YouTube પર પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાથી અને અન્ય દેશોમાંથી ૧૬૦૦ કરતાં વધુ લોકોએ આ વેબીનારનો લાભ લઈ આ રોગ વિષે માહિતગાર થયા હતા.

વિષય નિષ્ણાતો તરીકે ડૉ. સિમ્મી તિવારી, નાયબ નિયામકશ્રી, એન.સી.ડી.સી., ન્યૂ દિલ્હી દ્વારા હડકવાની મનુષ્ય પર થતી અસરો, રોગ નો પ્રભાવ અને તેના આર્થિક નુકસાન વિશે ઘણી વિસ્તૃત માહિતી આપવામાં આવી. ડૉ. રીટા મણિ, અધિક પ્રાધ્યાપક, NIMHANS દ્વારા આ રોગ વિશે હાલમાં ચાલી રહેલી સંશોધનો અને પ્રવર્તમાન પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી હતી. ડૉ. શ્રીકૃષ્ણ ઇસલૂર, જેઓ હડકવાના નિદાન માટે વૈશ્વિક સ્તરે પ્રમાણિત એવી ભારત સ્થિત એકમાત્ર પ્રયોગશાળાના વડા છે; તેઓએ હડકવાના નિદાનની પદ્ધતિ વિષે માહિતી આપી હતી. ડૉ. શશીકાંત જાદવ, ક્લિનિકલ ડાયરેક્ટર, જીવદયા ચેરીટેબલ દ્વારા હડકવાના નિદાનમાં ઉપયોગી થાય અને પશુ ચિકિત્સકો ને ફાયદાકારક એવી રોગના નમૂના એકત્ર કરવાની નિદાન પદ્ધતિ નું નિદર્શન કર્યું. આ ઉપરાંત વિષય નિષ્ણાતોએ વેબીનાર દરમ્યાન પ્રશ્નોત્તરીમાં પણ ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જે. એચ. ચૌધરી, મદદનીશ પ્રાધ્યાપક અને ડૉ. બી. સી. પરમાર, સહ-પ્રાધ્યાપક ડૉ. વી. આર. નિમાવત મદદનીશ પ્રાધ્યાપક અને ડૉ. ઉર્વીશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમના ઉપક્રમે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોસ્ટર સ્પર્ધા આયોજિત કરવામાં આવેલ હતી, જેમાં ૧૦૬ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે માટે ડૉ. બી. બી. ભંડેરી, ડૉ. આર. એ. માથકીયા, અને ડૉ. ડી. બી. સાધુ, મદદનીશ પ્રાધ્યાપક, વેટરીનરી કોલેજ આણંદ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતમાં ડૉ. જે. એચ. ચૌધરી દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો.